



অসম চৰকাৰ




Government of Assam



আ�াদারি দিহুনথাই আফাদ সমাজ হিসাব আনজাদ



আবাদারি দিহুনথাই আফাদ সমাজ হিসাব আনজাদ



আসাম গামিয়ারি দাথায় আৰো আবাদারি সিবিথাই আফাদ (এআরআইএস)

আবাদ কম্পলেক্স, খানাপারা, জি.এস.রড, গুৱাহাটী-৭৮১০২২


জায়গিজায়া অজদ/সোলু/হোফিননায় ফিননায়নি থাখায়
grievances@arias.in আৰো ইমেইল (email) খালাম

বেসেন-নাড়ৈ নম্বৰ: 1800-102-0338

একপিচি সমাজ হিসাব আনজাদনি গুৱার থাংখিআ জাবায

সমাজ সোদেৱনায় | বাহাগো লানায় | শেখা শেখা খালামনায় | হিসাব হোনো বাধ্য খালামনায়

- সিবিথাই রাহাফোৱা সাসেনিফ্রায় গুৰুন সাসেনিয়াৰ সৌহৈনায় আৰো জায়গানি আফাদনি সাসন খালামনায়নি উন ফিথাইখো নোজোৰ হোনায় আৰো মা঵সোলো দাগ্রাফোৱনো বিনি ফাৰ্সে মিথিহোনায়;
- সিবিথাইনি সোমোন্দে সোদ্রোমাফোৱনি বিবুংথিখৌ নায়বিজিটনায়,
- জায়গানি আফাদনি সাসন খালামনায়নি সোমোন্দে নোগোৱারিফোৱনি গিযানখৌ সুনায় আৰো বিথাংমোননি বাহাগো লানায়খৌ নায়বিজিটনায়;
- সোদ্রোমাফোৱ আৰো সিবিথাই হোগ্রা হান্জাফোৱনি গেজেটাৰ সাবৰায়লায়নায়খৌ বাংহোনায়; আৰো
- সিবিথাইনি মানদান্দা আৰো মোন্জায়-মোনেনি সায়াৰ নোজোৰ হোনায়াৰ সোদ্রোমাফোৱনি বাহাগো লানায়খৌ বাংহোনায়।



સમાજ હિસાબ આનજાદ ખાલામનાયનિ માનદાન્દા દિન્યિગ્રાફોર્ટ

સમાજ સોદેરનાય

રાહા મોનગિટિફોરખૌ દાનખ'નાય/સોમન્નાય, ઓન્સોલખૌ દિન્યિફુંનાય, આઇજો, હેંથા ગોનાં આરો રાહા ગૈજાયૈ સું

થિ ખાન્દ્યાવ (સાયખ'નાયનિ નેમ) થાનાંગૌ

- બિઅદિ આરો એસાએચિ આવ આઇજોનિ સાનખો, એસાટિ, એસાચિ સોદ્રોમાફોર
- થિ બિબાનિ થાન્દે
- સુમાન ખાબુ
- ગોહો ગોનાં ખાલામનાયનિ ફાર્સેં હાબાફારિ
- એફપિચિનિ હાબાફારિઆ રાહા મોનગિટિફોરનિ થાખો થિ ખાલામનાય



બાહાગો લાનાય

માવસોલો થિ ખાલામનાય, માવફુંનાય, નોજોર હોનાય,
નાયબિનિટનાય આરો ગોહોમ ખોછ્લૈનાય સમાવ

- મેલ જુથુમનાયનિ અન્જિમા
- સોદ્રોમાફોરનિ બાહાગો લાનાયનિ બિબાં
- સાવરાયલાયનાયનિ અન્જિમા
- સોદ્રોમાફોરનિ બાહાગો લાનાયનિ વિબાં
- બાહાગો લાનાયખો બાંહોનો થાખાય નેમ ખાન્દ્યિફોરખો ગોલેં ખાલામનાય
- સોદ્રોમાફોરનિ બાહાગો લાનાયનિ વિબાં
- બાહાગો લાનાયખો બાંહોનો થાખાય નેમ ખાન્દ્યિફોરખો ગોલેં ખાલામનાય



રોખા રોખા ખાલામનાય

ખૌરાં, ગોલેંયૈ મોન્નો હાથાવના આરો બાહાયજાથાવના

- સુબુંખાન્દ્યારિ આદબજોનિ થિટાંથા ખાલામનાય
- થિટાંથા લાનાયાવ હિસાબ લાખિનાય આરો હાબાફારિ/સિવિથાડખો માવફુંનાયાવ
લાખોમાનાય ગૈરે ખાલામનાય
- ફોરમાયનાયનિ બિબાં આરો આદબ
- ગોસાઈહોનો થાખાય આઇફિચિ બેસાદ,
- બિનોં આરો ફર્મફોરખો બાહાયનાય
- ખૌરાંફોરખો ગોલેંયૈ મોન્નો હાથાવના ખાલામનાય
- ખૌરાંફોરખો ગોલેંયૈ બાહાયજાથાવના ખાલામનાય
- સમાજજોં મોન્નાયનિ ફારિખાન્દી



હિસાબ હોનાય

સિનિ આરો બાયજોનિ જેનાફોરખૌ નાયબિનિટનાય આરો
ફોસાબનાયનિ ગેજેરજોં સમાજનિ બિબાનખૌ દિન્યિફુંનાય

- નાયબિનિટનાયનિ અન્જિમા
- ફિથાડ ગોનાં જેના સુસ્થાંનાય
- ફિથિન્નાય રાદાબખો આજાવનો આરો ફિન હોનાયનિ ગોહો થાનાય



સમાજ હિસાબ આનજાદનિ કાલામનાયનિ

એસાએચિખૌ દાનાય

- એસાએચિનિ સોદ્રોમાફોરખૌ ફોરોંથાય હોનાય
- દાનારિ સમાજ હિસાબ આનજાદનિ સમનિ ફારિલાડખૌ થિ ખાલામનાય
- એફપિઅનિ ડચિનો લાઇજામ દૈથાયહનાય સમાજ હિસાબ આનજાદનિ સમનિ ફારિલાડખૌ મિથિહોનો થાખાય
- એફપિઅનિ ડચિઆ જિબિનિ મેલ ખુંનાય
- એસાએચિઆ જિબિનો સમાજ હિસાબ આનજાદ ખાલામનાયાવ ગોનાંથિ જાનાય
ફોરમાન બિલાડ/ખૌરાંનિ ગોનાંથિ જાનાય, માખો હિસાબ આનજાદ ખાલામનાંગૌ,
જિબિ સોદ્રોમાફોરનિ મોન્ધાય બાયદિ ફોરનિ સોમોન્દે મિથિહોનાય

સમાજ હિસાબ આનજાદનિ હાબાફારિનિ સોમોન્દે ખૌરાં લાનાય

ખૌરાંખો રિજાયનાય

સમાજ હિસાબ આનજાદ આરો બિનિ મોન્ધાયનિ સોમોન્દે જિબિનિ સોદ્રોમા આરો ગુબુન
હાન્જાનિ ગેજેરાવ સાંગ્રાંથિ લાબોનાય

જાયગાયાવ થાંના હાબાફારિખો ટોખા ખાલામનાય, જિબિનિ સોદ્રોમાફોરજોં
સાવરાયનાય, માવફું બિફાન/એનેન્સી, એનજિઅ/ચિબિઅ બાયદિ બાયદિ ફોરા જોબ્બાય

સમાજ હિસાબ આનજાદનિ મેલ ખુંનાય

જાયગાયાવ થાંના નાયગિદિનાયનિ ખૌરાંનિ સોમોન્દે એફપિઅનિ ડચિજોં
સાવરાયલાયનાય

સમાજ હિસાબ આનજાદનિ ખૌરાંખો થિયારિ ખાલામનાય

જિબિ મેલાવ સમાજ હિસાબ આનજાદનિ ખૌરાંખો દૈખાનાય ગનાયથિ મોન્નો થાખાય

સમાજ હિસાબ આનજાદનિ ખૌરાંખો જિલ્લાનિ માવફું બિફાનફોરનિ માવખ'/એનેન્સી
આરો દિએલચિચિનો દૈથાયહનાય

સમાજ હિસાબ આનજાદનિ ખૌરાંખો બેખેવનાનૈ હોનાય

સમાજ હિસાબ આનજાદનિ ફિથાડનિ સાયાવ હાબા માવનાય